



# જીલ્લા કૃષિ હવામાન એકમ (DAMU)

ગ્રામીણ કૃષિ મૌસમ સેવા (GKMS)

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનીવર્સિટી

અમદેલી-૩૬૫૬૦૧

કોન નં. ૦૨૭૬૨ ૨૨૭૧૨૨



(જૂનાગઢ કૃષિ યુનીવર્સિટી અને ભારત મૌસમ વિભાગ દ્વારા સંપત્તિ)

આજાદી  
કા  
અમૃત મહોત્સવ

#AmritMahotsav



અહીં ક્લિક કરી કૃષિ હવામાન બુલેટીન અંગે આપના પ્રતિભાવ અવશ્ય જણાવો



અમદેલી જીલ્લાના તાલુકાઓ મુજબની હવામાન આધારિત કૃષિ સત્તાહ માટે ટેલીગ્રામ અથવા વોટ્સઅપ



ગુપ્તમાં જોડાવા અંતિમ પેજની મુલાકાત લો

અમદેલી કૃષિ હવામાન બુલેટીન ક. ૭૫/૨૦૨૧

તા. ૧૭-૦૯-૨૦૨૧

## પાછલા અઠવાડીયાનું અમદેલીનું હવામાન

#	હવામાન પરિબળો	11/09/2021	12/09/2021	13/09/2021	14/09/2021	15/09/2021	16/09/2021	17/09/2021
૧	વરસાદ (મી.મી.)	4.5	0	13	16.5	6.5	5	7.5
૨	મહત્તમ તાપમાન (°સે.)	31.8	29.4	27.6	32.8	30	30.9	29.7
૩	લઘુત્તમ તાપમાન (°સે.)	25.4	25.8	25.1	23.7	25.6	25.8	25.3
૪	મહત્તમ બેજ સવાર (%)	100	100	100	100	100	100	98
૫	લઘુત્તમ બેજ બપોર (%)	74	86	91	72	85	80	81
૬	પવનની ગતિ (કિ.મી./કલાક)	14.25	14.88	19.83	18.50	10.55	10.47	14.8
૭	પવનની દિશા (ડિગ્રી)	નૈઝેટ્ય-225	પશ્ચિમ નૈઝેટ્ય-253	પશ્ચિમ નૈઝેટ્ય-249	પશ્ચિમ નૈઝેટ્ય-253	નૈઝેટ્ય-218	પૂર્વ અધ્રે-120	દક્ષિણ નૈઝેટ્ય-201
૮	વાદળની સ્થિતિ (ઓક્ટો) માંથી	૮	૭	૧૩	૬	૭	૮	૮

અમદેલી જીલ્લાની તા. 18/09/2021 થી 22/09/2021 ની હવામાન આગાહી:

#	હવામાન પરિબળો	18/09/2021	19/09/2021	20/09/2021	21/09/2021	22/09/2021
૧	વરસાદ (મી.મી.)	31	30	65	65	65
૨	મહત્તમ તાપમાન (°સે.)	32	33	33	32	32
૩	લઘુત્તમ તાપમાન (°સે.)	24	24	25	25	25
૪	મહત્તમ બેજ સવાર (%)	93	94	93	92	89
૫	લઘુત્તમ બેજ બપોર (%)	77	73	70	72	75
૬	પવનની ગતિ (કિ.મી./કલાક)	17.3	15.9	16.5	19.9	22.9
૭	પવનની દિશા (ડિગ્રી)	પશ્ચિમ નૈઝેટ્ય-248	પશ્ચિમ નૈઝેટ્ય-248	પશ્ચિમ નૈઝેટ્ય-248	પશ્ચિમ નૈઝેટ્ય-248	પશ્ચિમ નૈઝેટ્ય-249
૮	વાદળની સ્થિતિ (ઓક્ટો) માંથી	૬	૪	૮	૭	૮

નોંધ: આ આગાહી સમગ્ર જીલ્લાની સરેરાશ હોય છે એટલે તેને કોઈ પણ એક જગ્યા માટે લગ્નુ કરવી નહિ.

## કૃષિ સત્તાહ

હવામાન સારાંશ	અમદેલી જીલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન બેજવાળું અને મોટાભાગે વાદળછાણું રહેવાની શક્યતા છે. આગામી ૫ દિવસ દરમિયાન જીલ્લાના અમુક વિસ્તારોમાં મધ્યમ થી ભારે, ધ્રાણ વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા શક્યતા છે. તા. ૨૦ થી ૨૨ સપ્ટેમ્બરમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે. લઘુત્તમ તાપમાન ૨૪-૨૫ °સે અને મહત્તમ તાપમાન ૩૨-૩૩ °સે રહેવાની શક્યતા
---------------	--


પવનની ગતિ સામાન્ય કરતા વધુ અંદાજીત ૧૬ થી રે કીમી/કલાકના ઝાટકા સાથે, દિશા મોટાભાગે પશ્ચિમ નૈન્ય

**આગોતરનું અનુમાન:** તા. રે થી રે ૮૮ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને કશ્ય વિસ્તારમાં ઘણી જગ્યાઓ પર હળવા થી મધ્યમ અને અમૃક જગ્યાઓ પર મધ્યમ થી ભારે વરસાદની શક્યતા છે. કુલ વિસ્તારના સરેરાશ મુજબ વરસાદ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું અને લઘુતું તાપમાન સામાન્ય રહેવાની શક્યતા છે.

- |                    |  |
|--------------------|--|
| <b>સામાન્ય ફૂલ</b> | <ul style="list-style-type: none"> <li>○ આગામી દિવસો માં ઘણી જગ્યાઓ પર મધ્યમ થી ભારે વરસાદની શક્યતા હોવાથી જંતુનાશક દવાઓ, ખાતરો નો છંટકાવ કરવો નહિ, રોગ-જીવાતનો વધુ ઉપદ્રવ હોય તો</li> <li>○ કપાસના પાકમાં કુલ ચાપકા ખરી જતા અટકાવવા માટે નોયેલીક એસેટિક એસીડ ૪.૫% દવા ૫ મિલી પ્રતિ દસ લીટર છંટકાવ કરવો.</li> <li>○ મગફળીમાં ગેલના નિયંત્રણ માટે કલોરોથેલોનીલ (૭૫ વેપા) અથવા મેન્કોરેબ (૭૫ વેપા) દવા ૪૦ ગ્રામ પ્રતિ પંપ વરાપે છાંટવી.</li> <li>○ વધુ વરસાદને લીધે ડોઈ પાક નિષ્ફળ ગયો હોય તો ૭૫ થી ૨૦ દિવસમાં શાયડો અને પૂર્વ શિયાળુ બાજરી નું વાવેતર કરી શકાય છે.</li> </ul> |
| <b>SMS</b>         | <ul style="list-style-type: none"> <li>○ કપાસના પાન પીળા અને લાલ થઈ જતા હોય તો, ૧૬-૧૬-૧૬ (ના. ફો. પો.) ખાતર ૧૦૦ ગ્રામ અને માઇકોમીક્સ (ગ્રે-૪) ૨૫ ગ્રામ પ્રતિ પંપ નાખી બે થી નરા વાર વરાપે છંટકાવ કરવો.</li> </ul>  |

### પાક મુજબ ફૂલ સલાહ

પાક	પાક અવસ્થા	કામગીરી / જાત / રોગ/ જીવાત	ફૂલ સલાહ
<b>કુંગળી (ચોમાસુ)</b>	વૃદ્ધિ અને કંદનો વિકાસ	કંદનો સર્જો	 <p>કોપરાઓડિસકલોરાઈડ (૫૦ વેપા) ૫૦૦ ગ્રામ + કર્બન્ડાજીમ ૧૫૦ ગ્રામ પ્રતિ એકર મુજબ પિયત સાથે આપવું.</p>
<b>મગફળી (ચોમાસુ)</b>	કુલ થી સુયા અને ધૈણ બંધાવવાની અવસ્થા/ પાક અવસ્થા		 <p>ઉપદ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકષ્યેલ ઢાલિયા તેમજ પાન ખાનાર ઇયળના કૂદાનો નાશ કરવો. બીભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્રિનાલફૂસ ૨૫ ઈસી અથવા કલોરાયરીફોસ ૨૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જો પિયત આપવાનું થતું ન હોય અને સમયાંતરે વરસાદ પડતો હોય તો ક્રીટનાશક છાંટવાના પંપમાં દ્રાવણ ભરી તેની નોઝલ કાઢી લઈ ચાસમાં પૂરતા પ્રમાણમાં આપવી.</p>
<b>પાન ખાનાર ઈયળ (સ્પોરોટેરા)</b>			<ul style="list-style-type: none"> <li>• ઉપદ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકષ્યેલ ઢાલિયા તેમજ પાન ખાનાર ઇયળના કૂદાનો નાશ કરવો.</li> <li>• સામૂહિક ધોરણે ફેરોમોન ટ્રેપ ૪૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવી આ જીવાતની વરસી કાખૂમાં રાખી શકાય.</li> </ul> <p>ઉપદ્રવની શરૂઆતમાં લીનોળીના મીજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર ક્રીટનાશક ૨૦ મીલિ (૧ ઈસી) થી ૪૦ મીલિ (૦.૧૫ ઈસી) અથવા બ્યુવેરીયા બેસીયાના નામની કૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેગવી વરાપ થયે છંટકાવ કરવો. ઉપદ્રવ વધુ જણાય ત્યારે ફુલ્યુબેન્ડિયામાઈડ ૨૦ ડબલ્યુજી ૬ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૨૦ ગ્રામ અથવા ઇન્ડોકાર્બ ૧૪.૫ એસ્સી ૧૦ મીલિ ૧૦ લિટર પાણીમાં ભેગવી વરાપ થયે છંટકાવ કરવો.</p> 

<b>ઉગસુક/ કોલાર ટોટ/સફેદ ફૂળ</b>	<ul style="list-style-type: none"> <li>છોડનું જમીનમાંથી સ્કૂરણ થઈ ગયા બાદ લગભગ દોઢ માસ સુધી આ ફૂળના કારણે જમીનની સપાટીએથી છોડ તૂટી જાય છે.</li> <li>દ્રાયકોર્ડરમાં પાવડર ૨.૫ ક્રિ.ગ્રા પ્રતિ હેક્ટરે ૫૦૦ કિલોગ્રામ દીવેલીને ખોળ સાથે આપવું.</li> <li>ઉપદ્રવ વધારે જણાય તો, કાર્બન્ડાઈમ ૦.૦૫ % ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી મિશ્રણ કરી મૂળ વિસ્તારમાં રેડવું (ડ્રિન્ચિંગ કરવું).</li> </ul>	
<b>ગેઝ</b>	 <p>કલોરોથેલોનીલ ૭૫ વેપા ૨૭ ગ્રામ અથવા મેઝોઝેબ ૭૫ વેપા ૨૭ ગ્રામ અથવા હેફ્કાઝોનાઝોલ ૫ ઈસી ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા અથવા લીમડાના તાજા પાનનો અર્ક ૧ ટકા દ્રાવણનો વરાપ થયે છંટકાવ કરવો.</p>	
<b>તળ કોરી (વાયર વોર્મ)</b>	 <p>પ્રતિ હેક્ટરે ફોરેટ ૧૦ કિલોગ્રામ મૂળમાં આપવું.</p>	
<b>કુંગળી (અર્દ શિયાળુ)</b>	<b>હેર રોપણી</b>	<ul style="list-style-type: none"> <li>૪૦ થી ૪૫ દિવસનું ધર્ણ થાય એટલે વારાપે હેરરોપણી કરવી.</li> </ul>
<b>મૂળનો સડો</b>	<ul style="list-style-type: none"> <li>મૂળનો સડો ના આવે તેના આગોતરા રસાયણિક નિયંત્રણ માટે ધર્ણને કાર્બન્ડાઈમ (૫૦ વેપા)</li> </ul>	
<b>એંટડા</b>	<b>વાનસ્પતિક વૃષ્ટિ ઘોડીયા ઈયળ</b>	 <p>ઘોડીયા ઈયળના નિયંત્રણ માટે કવીનાલફોસ (૦.૦૫%) ૨૦ મી.લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે જરૂરીયાત મુજબ વરાપે છંટકાવ કરવો. સફેદ માખીના નિયંત્રણ માટે એસિટિએપ્રાઇડ ૨૦ એસ. પી. ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.</p>
<b>ચુસીયા પ્રકાસની જીવતો</b>	 <p>તડતીયા, શ્રીપ્સ અને સફેદ માખીના</p> <p>નિયંત્રણ માટે મોનોકોટોફોસ (૦.૦૫%) ૧૫ મી.લિ. અથવા ડાયમીથોએટ (૦.૦૩%) ૧૫ મી.લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે જરૂરીયાત મુજબ વરાપે છંટકાવ કરવો. સફેદ માખીના નિયંત્રણ માટે એસિટિએપ્રાઇડ ૨૦ એસ. પી. ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.</p>	
<b>કપાસ</b>	<b>સુકારો</b>	 <ul style="list-style-type: none"> <li>દ્રાયકોર્ડર્માં પાઉડર ૨.૫ કિલોગ્રામ પ્રતિ હેક્ટર દીવેલીના ખોળ સાથે જમીનમાં આપવો.</li> </ul>
<b>વાનસ્પતિક વૃષ્ટિ થી ચાબખા</b>	<b>ખાતર</b>	<ul style="list-style-type: none"> <li>વાવણીના ૧૨માં અઠવાડિયે (૮૦ થી ૬૦ દિવસે) ચુરીયા ખાતરનો ત્રીજો (૧૨૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર) હમો આપવો.</li> </ul>
<b>અવસ્થા</b>	<b>વૃષ્ટિ વર્ધક</b>	<ul style="list-style-type: none"> <li>કપાસનો પાક ૫૦ થી ૭૦ દિવસનો થાય ત્યારે વરાપ થયે નેથેલીક એસિટીક એસીડ (૩ ગ્રામ/૧૦ લિટર) છંટકાવ કરવાથી કલોરોફ્લીલ, પાનની જડાઈ, ચાબખાની સંખ્યા અને સીમ્પોડીયાની લંબાઈ માં વધારો થવાને લીધે ઉત્પાદન વધારી શકાય છે.</li> <li>બી.ટી. કપાસનું વાવેતર કરતા ખેડૂતોને વધારે ઉત્પાદન, અને કપાસની સારી વૃષ્ટિ કરવા ૫૦ દિવસે અને ૭૦ દિવસે ૩૦ પીપીએમ (૦.૩ ગ્રામ/૧૦ લી. પાણીમા) વૃષ્ટિ વર્ધક નેથેલીનું એસિટીક એસિટિનો છંટકાવ કરવાથી પાનનાં હરિતદ્રવ્યમાં, પાનની જડાઈમાં, ચાંપવામાં, સિમ્પોડીયાની લંબાઈ તેમજ જુંડવાની સંખ્યામાં વધારાના કારણે ઉત્પાદનમાં વધારો થાય છે.</li> </ul>

## ગુલાબી ઈયળ



- કપાસમાં ગુલાબી ઈયળની મોજણી માટે પ્રતિ એકરે બે ફ્રેમેન ટ્રેપ (લ્યુર સાથે) લગાડવા, રોજ કૂદાની સંખ્યા તપાસવી અને સતત ૩ દિવસ સુધી સરેરાશ ૮ નર કૂદા પકડાય તો લીંબોળીના મીજ ૫% અથવા લીંબોળીનું તેલ ૫૦ મિલી પ્રતિ ૧૦ લીટર વરાપ થયે છંટકાવ કરવો.

- ગુલાબી ઈયળના સંપૂર્ણ સંકલિત નિયંત્રણી માહિતી માટે અહીં ક્લિક કરો**

### પાન પીળા/લાલ પડી જવા



પોષક તત્વોની ઉણપના લીધે કપાસના પાન પીળા અને લાલ પડી જતા હોય તો, તાલાલીક પોષક તત્વોની પૂર્તિ કરવા બાબતમાં મળતા ૧૮-૧૯-૧૯ (ના. ટો. પો.) એક પંપમાં ૧૦૦ ગ્રામ અને માઈક્રોમીક્સ (ગ્રેડ-૪) રૂપ ગ્રામ નાખી બે થી ત્રણ વાર છંટકાવ વરાપે કરવો જોઈએ. જેથી પાન પીળા/લાલ થતા અટકાવી શકાય.

### કૂલ ચાપકા ખરી જવા

- કપાસના પાકમાં કૂલ ચાપકા ખરી જતા અટકાવવા માટે નેથેલીક એસેટિક એસેડ ૪.૫% દ્વારા મિલી પ્રતિ દસ લીટર વરાપ થયે છંટકાવ કરવો.**
- બી.ટી. કપાસનું વાવેતર કરતા ખેડૂતોને વધારે ઉત્પાદન, અને કપાસની સારી વૃદ્ધિ કરવા ૫૦ દિવસે અને ૭૦ દિવસે ૩૦ પીપીએમ (૦.૩ ગ્રામ/૧૦ લી. પાણીમા) વૃદ્ધિ વર્ધક નેથેલીન એસેટીક એસેડનો છંટકાવ કરવાથી પાનનાં હરિત્રદ્વયમાં, પાનની જડાઈમાં, ચાંપવામાં, સિમ્પોડીયાની લંબાઈ તેમજ જુંડવાની સંખ્યામાં વધારાના કારણે ઉત્પાદનમાં વધારો થાય છે.

### તલ (ચોમાસુ)

કૂલ અવસ્થા/  
બેંઢા અવસ્થા

- ઘેતરમાંથી વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી

### તુવેર

વાવેતર થી  
ઉગાવો

- ઘેતરમાંથી વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી

### મકાઈ

પાનનો સૂક્કારો/  
મેઇઝીસ લીફ  
બલાઈટ



- ટેબૂકોનાજોલ રૂપ ઇસી ૧૦ મિ.લિ. અથવા પ્રોપોકોનાઝોલ રૂપ ઇસી ૧૦ મિ.લિ. અથવા મેસ્કોઝેબ ૭૫ વેપા ૨૭ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેણવી છંટકાવ કરવો અથવા ૧૦ % ગૌમૂર (૧ લીટર પ્રતિ ૧૦ લીટર પાણી) અથવા લીમડાના પાનનો ૧૦ % અર્કનો જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

### મરચી

- ઘેતરમાંથી વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી

### સુર્યમુખી

ધરણ ઉછેર/રોપણી  
વાવેતર

- ઘેતરમાંથી વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી

### શાકભાજુ

ધરણ ઉછેર/રોપણી  
વાવેતર

- મરચી, ટમેટો, રીગણ, અને કોબીઝુના ધરણ તૈયાર કરવા (ગ્રીન શેડ નેટમાં અને નેટની ઊચાઈ ડા.૫ કૂટ રાખવી) ગાંદી ક્યારા બનાવી તેમાં બીજનું વાવેતર કરવું. ધરણ તૈયાર હોય તો ફેર રોપણી કરવી.
- જમીન જન્ય ફૂગનો ઉપદ્રવ ના થાય તે માટે બીજને મેસ્કોઝેબ અથવા થાયરમ અથવા વીટાવેક્ષ પૈકી કોઈ એક દવાનો ૨-૨.૫ ગ્રામ પ્રતિ ડિલ્વો બીજ મુજબ પટ આપવો. તેમજ વાવેતર બાદ ૧૦-૧૫ દિવસે મેસ્કોઝેબ ૭૫ % વે.પા.નું ૨.૫ ગ્રામ પ્રતિ લીટર પાણીમાં મિશ્ર કરી ધરણના ક્યારામાં ડ્રેન્ચિંગ કરવું જેથી સુકારો ના આવે.

ધરણ મુન્ચુ/ ધરણો  
કોહવારો



- રોગ દેખાય ત્યારે એઝોક્લિસસ્ટ્રોબીન ૨૩ એસ્સી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણી અથવા ફેનામીઝોન ૧૦% + મેસ્કોઝેબ ૫૦% વેપા ૩૦ ગ્રામ ૧૦ લિટર પાણીનો છંટકાવ કરવો અથવા મેટાલેક્સીલ એમેઝેડ ૬૮ વેપા ૨૦૦ લિટર પાણીમાં ૩૨ ગ્રામ મુજબ ઓગાળી એક ગુંડા વિસ્તારમાં ઝારાથી રેડવું અથવા બોર્ડો મિશ્રાણણું દ્રાવણ ઝારાની મદદથી પ્રતિ ચોરસ મીટરે ૨ લીટર મુજબ આપવું.

<b>કોકડવા</b> 	<ul style="list-style-type: none"> <li>રોગનો ફેલાવો સહેદમાણીથી થતો હોઈ તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેશ્નીન ૩૦ ઇસી ૩.૪ મિ.લિ. અથવા પાયરીપ્રોક્ષીફીન ૧૦ ઇસી ૧૬.૬૭ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્દ્રાનિલિપ્રોલ ૧૦.૨૬ ઓટો ૧૮ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સ્પાયરોમેસીફીન ૨૨.૬ એસસી ૧૨.૫ મિ.લિ. અથવા થાયામેથોક્ઝામ રૂપ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ઇમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેગવી વરાપ થયે છંટકાવ કરવો.</li> </ul>
<b>પશુપાલન</b> 	<b>જીવાત નિયંત્રણ</b> <ul style="list-style-type: none"> <li>પશુઓમાં બાળ્ય પરોપજીવિના નિયંત્રણ માટે તેના શરીર પર મેલેથિયોન અથવા સાયપરમેશ્રિન @ ૩ મિ.લિ. પ્રતિ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.</li> <li>પશુઓના શેડના ફિનાઈલ P.O મિલી પ્રતિ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.</li> </ul>
<b>પોણણા</b>	<ul style="list-style-type: none"> <li>પશુઓની પૌષ્ટિક આવશ્યકતાને પૂરક બનાવવા માટે ૫૦ ગ્રામ ખનિજ મિશ્રણ પ્રતિટિન અન્ય ખોરાક સાથે મિશ્ર કરી આપવું.</li> </ul>
<b>કરમિયા</b>	  <p>વધુ વરસાદને લીધે કરમિયાનું પ્રમાણ વધે છે, આથી દરેક પશુઓને ફૂમિનાશક દવાનો ડોઝ પશુ પ્રાથમિક કેન્દ્રનું માર્ગદર્શન વહી સત્વરે આપી દેવો</p>



કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી દ્વારા બનાવવામાં આવેલા અમરેલી જુલ્લાના  
હવામાન આધારિત કૃષિ સલાહ અંગેના તાલુકા મુજબના વોટ્સએપ  
ગુપમાં જોડાવા માટે તમારા તાલુકા પર ક્લિક કરો.



જુલ્લા કૃષિ હવામાન એકમ (DAMU), ગ્રામીણ કૃષિ મૌસમ સેવા (GKMS), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનીવર્સિટી,  
અમરેલી-૩૬૫૫૦૧, કોન નં. ૦૨૭૯૮૨ ૨૨૭૧૨૨

### અમરેલી જુલ્લો





**District Agrometeorological Unit (DAMU)**  
**Gramin Krishi Mausam Seva (GKMS)**  
**Krishi Vigyan Kendra**  
**Junagadh Agricultural University**  
**Amreli-365601**  
**Phone: 02792-227122**



Issued jointly by Junagadh Agricultural University and India Meteorological Department

आवाणी  
का  
अमृत महोत्सव  
**#AmritMahotsav**



Join our Telegram channel and Block wise WhatsApp groups



**Amreli District Agromet Advisory Service bulletin. No. 75 (2021)**

**Date:17-09-2021**

**Significant weather of past week, Amreli**

#	Parameter	11/09/2021	12/09/2021	13/09/2021	14/09/2021	15/09/2021	16/09/2021	17/09/2021
1	Rainfall (mm)	4.5	0	13	16.5	6.5	5	7.5
2	Max.Temp.(°C)	31.8	29.4	27.6	32.8	30	30.9	29.7
3	Min.Temp.(°C)	25.4	25.8	25.1	23.7	25.6	25.8	25.3
4	RH-I (%)	100	100	100	100	100	100	98
5	RH-II (%)	74	86	91	72	85	80	81
6	Wind Speed (kmph)	14.25	14.88	19.83	18.50	10.55	10.47	14.8
7	Wind Direction(deg.)	SW-225	WSW-253	WSW-249	WSW-253	SW-218	ESE-120	SSW-201
8	Total CC (octa) out of 8	7	7	13	6	7	8	8

**Weather Forecast from 18/09/2021 to 22/09/2021**

#	Parameter	18/09/2021	19/09/2021	20/09/2021	21/09/2021	22/09/2021
1	Rainfall (mm)	31	30	65	65	65
2	Max.Temp.(°C)	32	33	33	32	32
3	Min.Temp.(°C)	24	24	25	25	25
4	RH-I (%)	93	94	93	92	89
5	RH-II (%)	77	73	70	72	75
6	Wind Speed (kmph)	17.3	15.9	16.5	19.9	22.9
7	Wind Direction(deg.)	WSW-248	WSW-248	WSW-248	WSW-248	WSW-249
8	Total CC (octa) out of 8	6	4	8	7	8

**Note: Above forecast is the average situation of whole district**

**Agro-Advisory**



**Weather Summary**

- The weather in Amreli District is likely to be relatively humid, and mostly cloudy. The isolated Moderate to heavy to be likely, fairly widespread light to moderate rainfall to be likely from 18<sup>th</sup> to 22<sup>nd</sup> September over the district. The minimum temperature is likely to be 24-25 °C. The maximum temperature is expected to be 32-33 °C.
- Wind speed likely mostly from SW to NW with gusts of 16 to 22 km/h.

- Extended Range Forecast:** Extended Range Forecast: There is a probability of light to moderate rainfall in scattered places, and isolated moderate to heavy rainfall is likely in Saurashtra and Kutch region from 22<sup>nd</sup> to 28<sup>th</sup> September. The maximum likely below normal and minimum temperatures likely normal in this period.

- General Advisory**
- Do not spray pesticides and water-soluble fertilizers due to moderate to heavy rainfall forecasted in next five days.
  - If there shading of square and flowers in cotton, Spray naphthalic acetic acid 4.5% @ 5 ml in 10 liters of water.
  - Appy spray of Chlorothalonil 75 WP or Mancozeb 75 WP @ 40 g per pump for control of groundnut rust at clear weather condition.
  - If any crop failure due to heavy rainfall than sowing of mustard and Pre-Rabi millets can be done in 15 to 20 days.

**SMS Advisory:** If there is observed cotton leaves yellow and red, then spray 19-19-19 (N.P.K) @ 100g and Micromix (Grade-4) @ 25g per pump in 2 to 3 replications in clear weather condition.

Crops	Crop Stage	Practices	Advisory
<b>Onion (Kharif)</b>	Growth and Bulb Development	Fusarium basal rot/basal plate rot	<ul style="list-style-type: none"> <li>Apply Copper Oxychloride 50 WP @ 500 g and Carbendazim @ 150 g/acre with irrigation</li> </ul>
<b>Groundnut</b>	Pegging and Pod development	Rust	 <ul style="list-style-type: none"> <li>Appy three spray of Chlorothalonil 75 WP @ 27 g or Mancozeb 75 WP @ 27 g or Hexaconazole 5 EC @ 5 ml in 10 litres at intervals of 12 to 15 days or spray fresh neem leaf extract with 1% solution in clear weather condition.</li> </ul>
	Wireworm		 <ul style="list-style-type: none"> <li>Apply forate 10 G @ 10 kg/ha.</li> </ul>
	Collar rot/ Stem rot		 <ul style="list-style-type: none"> <li>Apply trichoderma spp. @ 2.5 kg with Castor cake @ 500 kg/ha</li> <li>If there is more infestation apply carbendazim 0.05% @ 15 g/pump as a drenching.</li> </ul>
<b>Onion (Pre-rabi)</b>	Bed Preparation	Damping off	<ul style="list-style-type: none"> <li>Apply Drenching of Metalaxyl 4%+Mancozeb 64% WP @ 9 g/15 lit. water or Copper oxychloride @ 36 g/10 lit. of water</li> </ul>

<b>Castor</b>	Vegetative Growth	Sucking pests		Apply monocrotophos 0.05% @ 15 ml of Dimethoate 0.03% @ 15 ml in 10 lit of water @ 15 days of interval. If there is more infestation of whitefly, spray acetamiprid 20 SP @ 3 g in 10 lit. of water in clear weather condition.
	Semilooper			Spray Quinalphos 0.05% @ 20 ml/10 lit. water at 15 days of interval in clear weather condition.
	Wilt			<ul style="list-style-type: none"> <li>Applying Trichoderma spp. @ 2.5 kg per hectare with castor cake in the soil.</li> </ul>
<b>Cotton</b>	Vegetative to first square	Growth enhancer		<ul style="list-style-type: none"> <li>Apply naphthalene acetic acid 30 ppm (0.3 g/10 lit water) at 50 and 70 days after sowing in clear weather condition to increase the yield by an increase in a number of chlorophylls, the thickness of leaves, squares, length of sympodia, and a number of bolls.</li> </ul>
	Pink Bollworm			<ul style="list-style-type: none"> <li>To survey pink bollworm in cotton, install two pheromone traps (with lure) per acre, check the average 8 male adults per days trapped for 3 consecutive days, then spray neem seed kernel extract 5% or neem oil @ 50 ml per 10 litres of water in clear weather condition.</li> </ul>
	Yellowing Leaves of cotton			<ul style="list-style-type: none"> <li>If there is observed cotton leaves yellow and red, then spray 19-19-19 (N.P.K) @ 100g and Micromix (Grade-4) @ 25g per pump in 2 to 3 replications in clear weather condition.</li> </ul>
	Fertilizer			<ul style="list-style-type: none"> <li>After 12th week of the sowing, apply 3rd split of urea in cotton @ 120 kg/ha</li> </ul>
	Growth enhancer			<ul style="list-style-type: none"> <li>If there shading of square and flowers in cotton, Spray naphthalic acetic acid 4.5% @ 5 ml in 10 liters of water in clear weather condition.</li> </ul>

<b>Pearl Millet</b>	Flowering to Blast Grain filling		Apply carbendazim 50 WP @ 10 g/lit. on initiation of the disease in the interval of 10 to 15 days in clear weather condition.
<b>Sesame</b>	<b>Flowering and capsule formation</b>		Drain out excess water from the field.
<b>Pigeon Pea</b>			Drain out excess water from the field.
<b>Maize</b>	maydis blight in maize		<ul style="list-style-type: none"> <li>• Spray, Tebuconazole 25 EC @10 ml or propiconazole 25 EC @10 ml or Mancozeb 75 WP @27 g in 10 liters of water or Cow urine @ 1 liter in 10 liters of water or 10% extract of neem leaves as required.</li> </ul>
<b>Chilli</b>			<ul style="list-style-type: none"> <li>• Drain out excess water from the field.</li> </ul>
<b>Sunflower</b>			<ul style="list-style-type: none"> <li>• Drain out excess water from the field.</li> </ul>
<b>Vegetable Crops</b>	Transplanting		<ul style="list-style-type: none"> <li>• Carry out transplanting for tomato, chili, brinjal and early cauliflower those who have seedlings ready for T.P.</li> <li>• To prevent soil borne disease drenching of nursery bed should be done with Mencozeb 75 % WP @ 2.5 gm/litre of water after 15 DAS.</li> </ul>
	Leaf miner		<p>Spray DDVP 76 EC 10 ml or Quinalphos 20 ml in 10 litres of water for control of leaf miner in clear weather condition.</p>
	Damping off		<p>When the disease appears, spray azoxystrobin 23 SC @10 ml or fenamidone 10% + Mancozeb 20% WP 30 gm in 10 liters of water or drenching of metalaxyl MZ 68 WP @ 32 g in 200 liters of water per 100 square meter or apply bordeaux mixure @ 2 litre per square meter in clear weather condition.</p>
<b>Livestock</b>	Pest & disease		<ul style="list-style-type: none"> <li>• To control of ectoparasites in cattle apply malathion or cypermethrin @ 3.0 ml/l of water on the body of cattles.</li> </ul>



- Spray phenyle @ 5.0 ml/l in floor of cattle shed. Close the window and doors with curtain.

#### Feed

- Provide 50 gm mineral mixture per animal for supplement the nutrient requirement.

#### Worms



- Infestation of worms is increase in excessive rainfall situation, apply deworming vaccine to each animals through guidance of primary animal health centre.

deworming vaccine to each animals through guidance of primary animal health centre.

**Click your block to join whatsapp group of DAMU**

